



# ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

ફોર્મ નં. -૮  
(નિયમ-૭)



## વિકાસ માટે પરવાનગી

પોલારીસ બિલ્ડકીન એલ.એલ.પી નામની ભાગીદારી પેઢી વતી તેના વહીવટકતીશ્રી મનીષભાઈ ભીમુભાઈ પટેલ ને રહેણાંક તથા વાણિજ્ય ડેટસર, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬(સન-૧૯૭૬ ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં. ૨૭) ની કલમ-૨૮(૧)(૧), ૨૮(૧)(૨), ૪૮(૧)(૮) હેઠળ મોઝે, સરગાસણ, તા. જી.ગાંધીનગર, રેવન્યુ સર્વીસ્/લોક નં. ૪૨૮/૧/૦૦૧, મુખાંડ નં. ૪૨૮/૧/૧, અંતિમાંડ નં. ૪૨૮/૧/૧ ની ૪૮૯૩.૦૦ ચોરસ મીટર જમીનમાં તેમની ફદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાયેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમ	ફ્લોરમાળા	બાંધકામ(બિલ્ટઅપ) નં ઉપયોગી ક્ષે. (ચો.મી)	બાંધકામનો ઉપયોગ	એકમની સંખ્યા	શીમાકર્ય
૧	૨	૩	૪	૫	૬
૦૧	બેઝમેન્ટ-૨	૩૬૭૪.૧૨	પાર્કિંગ	---	
૦૨	બેઝમેન્ટ-૧	૩૬૭૪.૧૨	પાર્કિંગ	---	
૦૩	ગ્રાઉન્ડ ફ્લોર (હાલોપ્ટીન્ય)	૨૧૭૪.૪૦	પાર્કિંગ	---	
૦૪	ગ્રાઉન્ડ ફ્લોર (સોલીડ પ્લીન્ય)	૮૮૨.૬૩	વાણિજ્ય	૧૮	
૦૫	ફર્સ્ટ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૦૬	સેકન્ડ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૦૭	થર્ડ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૦૮	શીર્ષ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૦૯	સીક્સ્થ ફ્લોર	૧૭૭૧.૦૦	રહેણાંક	૧૨	
૧૦	સીક્સ્થ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૧૧	સેવન્થ ફ્લોર	૧૭૭૧.૦૦	રહેણાંક	૧૨	
૧૨	એઠીથ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૧૩	નાઈન્થ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૧૪	ટેન્થ ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૧૫	ઇલેવન ફ્લોર	૧૭૧૦.૮૮	રહેણાંક	૧૨	
૧૬	ટેવેલ્થ ફ્લોર	૧૭૮૮.૬૮	રહેણાંક	૧૨	
૧૭	થીન્થ ફ્લોર	૧૪૮૮.૫૪	રહેણાંક	૦૮	
૧૮	સ્ટેર કેબીન	૨૬૦.૫૪	---	---	
૧૯	ઓવરરહેડ ટાંકી	૮૬.૬૧	---	---	
૨૦	કલબ હાઉસ	૧૨૦.૬૦	---	---	
કુલ.		૩૩૧૨૨.૧૭	રહેણાંક+વાણિજ્ય	રહેણાંક. ૧૫૨+ વાણિજ્ય. ૧૮=૧૭૦	

નોંધ. માન. મ્યુનિસીપલ કમિશનરશ્રીએ મંજુર કર્યો મુજબ.

ક્રમાંકાંગી. આર. એમ.જી. એમ.સી/૪૦/સરગાસણ/૦૧/૨૦૨૨/૭૨૪૨/૨૦૨૨

વપરાશ: રહેણાંક તથા વાણિજ્ય

તારીખ: ૦૭/૦૪/૨૨

*Patel*  
જીનીયર નગર નિયોજક  
ગાંધીનગર મણાનગરપાલિકા  
ગાંધીનગર



-: ખાસ શરતો :-

- (૦૧) આ વિકાસ પરવાનગીથી સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ના વિનયમ નં:૨૮ મુજબ તેમજ લાગુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ મળતી નથી.
- (૦૨) વિકાસ પરવાનગી મેળવ્યા બાદ સ્થળ ઉપર શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ ક્રીમ નં: ૦૨ (ડી) નું એનેક્ષર, સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ, વર્કિંગ ડ્રોઇંગ તથા સોઈલ ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ્સ નિયમોનુસાર ૨ જુલાઈ કરવાના રહેશે.
- (૦૩) બાંધકામના નીચેના તબક્કે ક્રીમ નં:૧૧ (નોટીસ ઓફ પ્રોર્ગેસ ઓફ કન્ટ્રક્શન) માં દર્શાવ્યા મુજબનું પ્રોર્ગેસ સર્ટીફીક્ટ રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- અ. પ્લીન્ચ અથવા ભૌયરાનું બાંધકામ હોય તો ભૌયરા ઉપરનો સ્લેબ ભરવામાં આવે તે પહેલા.
- બ. પ્રથમ માળના બાંધકામ વખતે.
- ક. વચ્ચગાળાના માળના બાંધકામ વખતે.
- ડ. છીલા માળના બાંધકામ વખતે.
- (૦૪) સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ની જોગવાઈ તથા સરકારશીના તા. ૧૨/૧૦/૨૦૧૭ ના સ્ટ્રક્ચર સેફ્ટી એંગેના વિનયમ નં:૦૩ અનુસાર બાંધકામના સ્થળની જરૂરીયતોની જોગવાઈઓનું પાલન થયેથી જ સ્થળ ઉપર બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- (૦૫) સેપ્ટીક ટેન્ક તથા સોકવેલની સાઈઝ તથા સંખ્યા નેશનલ બિલ્ડીંગ કોડ (આઈ.એસ. ૨૪૭૦) તથા સિવિલ એન્જિનીયરીંગ ફેન્ડલુક બાનાખત મુજબ ડેનેજ લે-આઉટમાં દર્શાવવાના રહેશે. તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આર્કિટેક/ઇંજનેર/સ્ટ્રક્ચરલ એન્જિનીયર/કલ્ચર ઓફ વર્કસ/સાઈટ સુપરવાઈઝર/ડિવલોપર/જમીન માલિકની રહેશે.
- (૦૬) વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર થયેલ નકશાઓનો એક સેટ સ્થળ ઉપર પ્રસિધ કરવાનો રહેશે.
- (૦૭) બાંધકામ પુર્ણ થયા બાદ જ વપરાશ શરૂ કરવાનો રહેશે.
- (૦૮) સદરહું જમીનનો બિનખેતીનો ઉપયોગ કરતાં પહેલા લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫ અન્વયેની સંબંધિત અધિકારીશીની જરૂરી પરવાનગી લેવાની રહેશે તેમજ બિનખેતી કરાવ્યા બાદ અન્ય કાયદા હેઠળ જરૂરી બાંધકામની પરવાનગી સ્થાનિક સંસ્થા પાસેથી મેળવીને બાંધકામ કરવાનું રહેશે. આ સિવાય કરેલ વિકાસ/બાંધકામ ગેરકાયદેસર ગગાશે.

- (૦૯) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૨૮ અન્વયે સદરહું જમીનમાં બાંધકામ મંજુર વિકાસ યોજના/નગર રચના યોજનાની દરમાસ્તો અને નિયમો મુજબ કરવાનું રહેશે.
- (૧૦) બાંધકામ પરવાનગી, સર્વે નં/બ્લોક નં અથવા અંતિમખંડ અગર સબપ્લોટમાં અરજદારશ્રી જે જમીનમાં કબજેદાર/માલિક છે તે જમીન પુરતી પરવાનગી આપવામાં આવે છે.
- (૧૧) આ પરવાનગીના કારણે અરજદારની માલિકી તથા જમીનનો હુદ્દ વિસ્તાર તથા ક્ષેત્રફળ અંગેની મંજુરી મળતી નથી. પરંતુ નિયમોનુસાર વિકાસ અંગેની મંજુરી મળે છે. તેમજ આ પરવાનગી અધિકૃત સનદ ટીપ્પણી, અંતિમખંડના માપને આધિન રહીને આપેલ ગણાશે.
- (૧૨) વિકાસ નકશામાં અને નગર રચના યોજનામાં જુદા-જુદા વિસ્તારમાં જમીનનો અને મકાનના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હ્યે તેની વિઝઘનો ઉપયોગ કરી શકશે નહિં. તેમજ મંજુર કરવામાં આવેલ વિકાસ પરવાનગી મુજબના નકશાના દરેક ખંડનો જે ઉપયોગ હ્યે તેથી જુદા ઉપયોગ અગાઉથી મંજુરી લીધા સિવાય કરી શકશે નહિં.
- (૧૩) વિકાસ પરવાનગી ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રવર્તમાન નિયમો મુજબ આપવામાં આવી છે અને ખાનગી હકકીના નુકશાનો અંગે મહાનગરપાલિકાની કોઈપણ જવાબદારી રહેતી નથી.
- (૧૪) વિકાસ પરવાનગી ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારી જોવા માંગે તો તે બતાવવા માલિક બંધાયેલા છે જો તે નહિં બતાવે તો તે બંધ કરવા હુકમ કરશે અને તે મુજબ કામ બંધ કરવાનું રહેશે. તેમજ વિકાસ પરવાનગી સાથે મંજુર કરાવેલ નકશાઓ (દેમીનેટ કરાવેલ) એક સેટ/નકલ સ્થળ પર રાખવાનો રહેશે તેમજ વિકાસ પરવાનગી નંબર/તારીખ તેમજ જમીનની વિગતો દર્શાવતું બોર્ડ પણ સ્થળે પ્રસિદ્ધ કરવાનું રહેશે.
- (૧૫) આ વિકાસ પરવાનગી આખ્યા તારીખથી ૧૨ માસ સુધી અમલમાં રહેશે તથા આ હુકમની તારીખથી નિયમોનુસાર મળવાપાત્ર સમયમર્યાદામાં આપેલ મંજુરી મુજબનું વિકાસ કાર્ય સમાયંતરે રીન્યુઅલ મેળવી પુર્ણ કરવાનું રહેશે.
- (૧૬) સવાલવાળી જમીન લેન્ડ એક્વીઝેશન એક્ટ-૧૯૮૪ મુજબ એન્કવાયર કરનારને સદરહું એકટની કલમ-૪ અન્વયે નોટીફિકેશનની કયું હ્યે તો એક્વીઝેશન એકટની કલમ-૨૪ (૭) મુજબ જુલા કલેક્ટરશ્રીની ૨૪ા, બાંધકામ શરૂ કરતા પહેલા લેવાની રહેશે.
- (૧૭) વખત તો વખત ગુડા/મ્યુનિસીપલ કાર્પોરેશન તરફથી તથા સરકારશ્રી તરફથી વિકાસ માટેના જે નિયમો કે સુચનાઓ તથા જાહેરાત કરાય તે બંધનકર્તી રહેશે.

- (૧૮) અરજદાર આ સત્તામંડળ તથા સરકારશી વખતો વખત નક્કી કરે તે મુજબના ડેવલપમેન્ટ ચાર્જસ, અન્ય ચાર્જસ ડીપોઝીટ તેમજ હી ભરવા જવાબદાર રહેશે.
- (૧૯) ઉપર જુણાવેલ શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો-૧૯૭૯ ની કલમ-૨૮/૫,૩૪,૩૬,૩૭,૪૮/૧ અને ૮૮ વિગેરેની જોગવાઈ મુજબ દંડ તથા શિક્ષાને પાત્ર રહેશે.
- (૨૦) જો પ્રશ્નવાળી જમીન ઉપર બોજો ફેશે તો ધિરાણ કરનાર સંસ્થાના કારણો તેમને બંધનકર્તા રહેશે.
- (૨૧) ગુજરાત ટ્રાઉન પ્લાનીગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૯ સિવાયના બીજા પ્રવર્તમાન કાયદાઓ ફેઠળ લેવા પાત્ર મંજુરીઓને આધિન રહીને વિકાસપરવાનગી આપવામાં આવે છે
- (૨૨) મંજુર થયેલ પ્લાન મુજબનો વિકાસ શરૂ કરતા પહેલાં સાત (૭) દિવસ અગાઉ નિયમોનુસાર ડીટેઇલ વર્કિંગ ટ્રોઇંગ તથા સ્ટ્રક્ચરલ ટ્રોઇંગ અતે રજુ રાખી તથા તેના આનુષ્ઠાંગિક રીપોર્ટ્સ સમયાંતરે અતે રજુ કરી તથા તબક્કાવાર પ્રગતિની અતે નિયત નમુનામાં જાણ કરી તપાસ કરાવવાની શરતોએ વિકાસ પરવાનગી આપવામાં આવતી હોઈ તેનો ભંગ થયેથી વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.
- (૨૩) રજુ થયેલ નકશામાં દર્શાવ્યા મુજબનો વિકાસ કરતાં પહેલાં સ્થળો ખાનગી ફક્કોને નુકશાન ન થાય તેમ યોગ્ય તે અધિકૃત પ્રવેશ રજુ કરેલ કરાર મુજબ મેળવી લેવાનો રહેશે.
- (૨૪) ઔઘોગિક/વાણિજ્ય બાંધકામને લગતા સરકારશીના જુદા-જુદા ખાતાઓના નિતી નિયમો પણ અરજદારશીને બંધનકર્તા રહેશે તથા તે અન્યયે સંબંધકુનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
- (૨૫) માર્જિનવાળા ભાગમાં, આંતરિક રસ્તા ઉપર અને કોમન પ્લોટમાં કોઈને અંતરાયરૂપ ન થાય તે રીતે યોગ્ય સ્થળો કુલ જમીનમાં વિસ્તારની ગણત્રી મુજબ ક્રોમ્ફ્રેન્સીલ સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ની જોગવાઈ મુજબ વૃક્ષો વાવવાના તથા ઉછિરવાના રહેશે તેમજ તે અન્યયે અરજદારશીને અતે આપેલ બાંધકારી મુજબનો અમલ કરવાનો રહેશે.
- (૨૬) વરસાદી કુદરતી પાણીના લેણને, અવરોધ ન થાય અને તેનો યોગ્ય રીતે અને સરળતાથી નિકાલ થાય તેવી જરૂરી વ્યવસ્થા રહેશે.

- (૨૭) સરકારશી દ્વારા મંજુર થયેલ અંતિમ નગર રચના યોજના નં.-“ગાંધીનગર મહાનગરપાલિકા” મુજબ કેસરી રંગથી દર્શાવેલ જમીનનો સમાવેશ અન્યની માલીકી જમીનમાં થતો હોઈ સદર નગર રચના યોજના થયે અંતિમખંડ મુજબની અન્યની માલિકીની જમીનનો પ્રત્યક્ષ કબજો જમીન માલિકને મળ્યા બાદ તેની સત્તામંડળની વિભિત્તમાં જાણ કરી પ્રસ્તુત જમીનમાં બાંધકામ/વિકાસ કાર્ય કરી શકાશે.
- (૨૮) લે-આઉટ ખાનમાં દર્શાવેલ ખુલ્લી જમીનમાં વોટર રીચાર્જા કુવા એંગેનું આયોજન રજુ કરેલ બાંધધરી મુજબ કરવાનું રહેશે.
- (૨૯) માન્ય લેબોરેટરીના સોઈલ ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ અન્વયે જમીન પર થનાર વિકાસ કાર્યનો થોગ્યતા અને સલામતીના માપદંડ તથા સુચિવેલ ભલામણોના અમલ કરી તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તે મુજબ બાંધકામની મજબુતાઈ અંગે સ્ટ્રક્ચરલ એન્જિનીયરે નકશા તૈયાર કરવાનાં રહેશે તથા બાંધકામ કરવાનું રહેશે તથા તેની જાણ સમયાંતરે સત્તામંડળને કરવાની રહેશે.
- (૩૦) મંજુર કરેલ આયોજનમાં નિયમ મુજબ સ્થળો રોડ સાઈડ ફંડ માર્જનમાં કચરા પેટી તથા ટપાલ બોક્ષને લગતી સુવિધા આયોજકે કરવાની રહેશે.
- (૩૧) રજુ કરેલ આયોજન સંદર્ભે મિલ્કટની સલામતી માટે ઠંડીયન સ્ટાન્ડર્ડ સ્પેશીઝિકેશન એન.એ.સી. નિયમોનુસાર સ્ટ્રક્ચરલ સ્ટેબીલિટી, શાથર સેફ્ટી તથા અન્ય બાબતો લક્ષ્યમાં લઈ વિકાસ કાર્ય/બાંધકામ કરવાનું રહેશે તથા તે અંગે જરૂરી સક્ષમ અધિકારી/વિભાગ તરફથી “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવી અતે રજુ કરવાનું રહેશે તથા તે અંગેની સંપુર્ણ જવાબદારી અરજદાર/ડિવલપરશ્રીની રહેશે.
- (૩૨) રજુ કરેલ લે-આઉટમાં દર્શાવેલ કોમન પ્લોટી માલિક બિનતબદીલ તથા અ-વિભાજ્ય સત્તા પ્રકારની રહેશે. તેમજ સદરહું લે-આઉટના મંજુર કરેલ તમામ પ્લોટ/ટિનામેન્ટના વખતો-વખતના માલિકીની પણ વાળવહેચાયેલ સમાન હિસ્સો રહેશે.
- (૩૩) સવાલવાળી જમીનમાં લો-કોસ્ટ ટાઇપ હાઉસનું આયોજન હોય, નિયમોનુસાર કો.ઓપરેટી હાઉસોંગ સોસાયટીનું રજુસ્ટ્રેશન કરાવીને તેના જરૂરી પુરાવા મંજુરી હુકમ તારીખથી ૭ (૬) માસમાં અતે રજુ કરવાના રહેશે.
- (૩૪) લે-આઉટમાં દર્શાવેલ ઓપન સ્પેશ, બાંધકામ નિયંત્રણ રેખા તથા કોમન પ્લોટની ખુલ્લી જમીનમાં કોઈપણ પ્રકારની બાંધકામ/વિકાસ કાર્ય કરવાનું રહેશે નહિં.

- (૩૫) મંજુર કરેલ આયોજનમાં નિયમોનુસાર સોસાયટીની ખુલ્લી જમીનમાં ઈલેક્ટ્રીકલ ટ્રાન્સર્વિર્મર માટેની જમીન અલગથી ફાળવી જે તે સુવિધા આયોજકે કરવાની રહેશે.
- (૩૬) અગાઉ તા. ૩૦/૦૮/૨૦૧૮ ના રોજ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીના બિનખેતી હુકમમાં નિર્દિષ્ટ શરતોનું પાલન કરવાનું રહેશે.
- (૩૭) ચીફ કાયર ઓફિસરશ્રીના અભિપ્રાય સ્થળ પર કાયર સેક્ટી અંગેની જોગવાઈ કરવાની રહેશે. તેમજ મેળવેલ વિકાસ પરવાનગી મુજબ સ્થળે બાંધકામ પૂર્ણ કરી કાયર સેક્ટી અંગેની જોગવાઈ કરી ચીફ કાયર ઓફિસરશ્રીનું “ના-વાંધા પ્રમાણપત્ર” તેમજ અત્રેથી વપરાશનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ બાંધકામનો ઉપયોગ કરી શકશે.
- (૩૮) નેશનલ બિલ્ડિંગ કોડની જોગવાઈઓનું ચુસ્તપણે એન્જીનીયરશ્રી/સ્ટ્રક્ચરલ એન્જીનીયરશ્રી/ તેવલોપરશ્રીએ ચુસ્તપણે અમલ કરી બાંધકામ કરવાનું રહેશે તથા ૨જુ કરેલ એફિડીવીટનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૩૯) મેળવેલ વિકાસ પરવાનગી મુજબની લીફ્ટ તથા કાયર લીફ્ટનું આયોજન કર્યો બાદ ચીફ લીફ્ટ ઇન્સ્પેક્ટરશ્રીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ લીફ્ટનો ઉપયોગ કરવાનો રહેશે.
- (૪૦) નેશનલ બિલ્ડિંગ કોડના ઉપલક્ષમાં કાયર કાઈટીંગ પ્રોવિઝન, અન્ડર ગ્રાઉન્ડ ટાંકીની જોગવાઈ વિગેરની સંબંધક ખાતાની એન.ઓ.સી. મેળવી લેવાની રહેશે.
- (૪૧) લીફ્ટ/દારરપિસેજ/કોરીડોર વિગેર માટે તથા ઇન્ટરનલ કાયર હાઇફન્ટ માટેની લાઈટીંગની/ઈલેક્ટ્રીક સર્કીટની અલાયદી વ્યવસ્થા જે તે સંબંધક ખાતાનું “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવી આયોજકે કરવાની રહેશે.
- (૪૨) સદર જમીનમાં બાંધકામ/વિકાસ શરૂ કરતા પહેલા સાઈટ સુપરવાઈઝરનું અત્રેનું જરૂરી રજુસ્ટ્રેશન મેળવી સ્થળે બાંધકામ/વિકાસ કરવાનો રહેશે.
- (૪૩) મેળવેલ વિકાસ પરવાનગી મુજબ સ્થળે બાંધકામ શરૂ કરતાં પહેલા વર્કિંગ ટ્રોંધિંગ સ્ટ્રક્ચરલ ટ્રોંધિંગ કોર્પોરેશનમાં ૨જુ કરવાના રહેશે તથા સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ની જોગવાઈ મુજબ દરેક બાંધકામનો તબક્કાવાર પ્રગતિ અહેવાલ સત્તામંડળમાં ૨જુ કરવાનો રહેશે. બાંધકામની સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી જળવાઈ રહે તે મુજબ બાંધકામ કરવાની સમગ્ર જવાબદારી એન્જીનીયરશ્રી/સ્ટ્રક્ચરલ એન્જીનીયરશ્રી/તેવલોપરશ્રીની રહેશે.
- (૪૪) ડ્રાઇટ સ્કીમ મુજબના અંતિમખંડ નં.: -...ની જમીનમાં મળતી અન્ય માલિકીની જમીનમાં સરકારશ્રી દ્વારા નગર રચના યોજના મંજુર થયા બાદ કાયદાકીય રીતે કબજો મેળવ્યા બાદ સદર જમીનમાં અત્રેની કચેરીની જાગું હેઠળ બાંધકામ કરવાનું રહેશે.

- (૪૫) સદર નકશામાં સુચવેલ ઉચાઈ પૈકીની ૪૪.૪૫ મીટર. ઉચાઈ સુધીનું બાંધકામ કરવા માટે જ આ પરવાનગી આપવામાં આવે છે.
- (૪૬) પ્રશ્ન હેઠળની જમીનનો સમાવેશ સરકારશીની અંતિમ નગર રચના યોજના નં. - ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં થતો હોઈ, આ નગર રચના યોજનાના તમામ નિર્ણય બંધનકર્તા રહેશે.
- (૪૭) નગર રચના યોજનાને સરકારશીની મંજુરી મળ્યેથી નિમાનાર નગર રચના અધિકારીશ્રી દ્વારા તેને અંતિમ કરતાં લે-આઉટ ખાન ઉપર દર્શાવેલ અંતિમખાંડની હણી/ક્ષેત્રકણ કે અન્ય દરખાસ્તો કેરક્ષારને પાત્ર હોઈ યોજના અંતિમ થતાં નગર રચના અધિકારીશ્રી દ્વારા લીધેલ નિર્ણય બંધનકર્તા રહેશે.
- (૪૮) પ્રશ્ન હેઠળની જમીનનો નગર રચના યોજના એંગેનો બેટરમેન્ટ ચાર્જ કોર્પોરેશન દ્વારા જુણાવ્યેથી સત્તવરે ભરપાઈ કરવાનો રહેશે તથા મંજુર લે-આઉટના સબપ્લોટ્સ/ ફ્લેટ્સ જે તે ઇસમ કે સંસ્થાને ભાડે યા વેચાણ આપતી વખતે તેનો ભાડાખત/વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવાનો રહેશે.
- (૪૯) સવાલવાળી જમીનના નગર રચના યોજના મુળખાંડમાંથી કપાત થતી જમીનના કબજા બાબતે આપેલ બાંધકામ મુજબનો અમલ કરવાનો રહેશે.
- (૫૦) નગર રચના યોજના અન્યથે અન્યની માલિકીની જમીનમાં કાળેલ અંતિમખાંડની જમીન અન્યથે અરજદારશીએ જે તે સંબંધિત જમીન માલિક/કબજેદારોની સંમતિ મેળવી તેનો કાયદાકીય જોગવાઈ અનુસાર પ્રત્યક્ષ કબજો કાયદાકીય રીતે મેળવી સવાલવાળી જમીનમાં વિકાસ કામ/બાંધકામ કરવાનું રહેશે.
- (૫૧) અરજદારશી ધ્વારા ૨૦,૦૦૦.૦૦ ચોરસ મીટરથી વધુનું બાંધકામ કરતાં પહેલા એન્વાયરમેન્ટ એન. ઓ. સી લાવી ગાંધીનગર મહાનગરપાલિકાએ કચેરીએ ૨૪ કરવાની રહેશે.
- (૫૨) ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશન, કાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની કચેરીના તા. ૧૮/૦૧/૨૦૨૨ ના પત્ર ક્રમાંક. GMC/GFES/PREE-NOC/R-7/016/2022 મુજબની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- (૫૩) “મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીઓ (રોજગારીનું નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ-૧૯૯૬ (the BOCW Act,1996) હેઠળ દરેક માલીકે બાંધકામ પ્રવૃત્તિ શરૂ થવાના (૩૦) દિવસ પહેલા સદર કાયદા હેઠળના નિયત નમુના-૪ માં નોટીસ મોકલી જાણ કરવી તેમજ કામકાજ શરૂ કર્યાના ૬૦ દિવસમાં જરૂરી સાઈટની નોંધણી નાયબ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, સી-બ્લોક, ૫ મો માળ, સહયોગ સંકુલ, પાયિકા આશ્રમ પાસે, સેક્ટર નં: ૧૧, ગાંધીનગર ખાતે ([www.ifsp.gujarat.gov.in](http://www.ifsp.gujarat.gov.in)) કરાવી તે અંગેનું પ્રમાણપત્ર મેળવી ઉક્ત કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે”
- (૫૪) ઉપરોક્ત જાણાવેલ કોઈપણ શરતનો ભંગ થશે તો આપેલ વિકાસ પરવાનગી આપો-આપ ૨૬ થયેલી ગણાશે.

નોંધ. માન. મ્યુનિસીપલ કમિશનરશીએ મંજુર કર્યો મુજબ.

ક્રમાંક: પી. આર. એમ:જી. એમ. સી/૪૦/સરગાસણ/૦૧/૨૦૨૨/૭૨૪૨/૨૦૨૨

વપરાશ: રહેણપાંક તથા વાણિજ્ય

તારીખ : ૦૭/૦૫/૨૦૨૨

નકલ રવાના: પ્રતિ,

જનરલ મેનેજરશી, ઇન્દ્રાજિત એલ. એ. કયુ, અવની ભવન, ચાંદ્ઘેડા, અમદાવાદ તરફે જાણ સારુ.

*Patel*  
જુનીયર નગર નિયોજક  
ગાંધીનગર મહાનગરપાલિકા  
ગાંધીનગર

